

<b>Water restrictions do's and don'ts</b>	<b>પાણી સંબંધિત પ્રતિબંધો શું કરવું અને શું ન કરવું</b>
The following is not allowed under the current Stage 4 water restrictions:	હાલમાં ચાલી રહેલાં પાણી સંબંધિત પ્રતિબંધોના તબક્કા 4 માં નીચે દર્શાવેલ બાબતો અંગે મંજૂરી નથી:
<b>All outdoor water use is temporarily banned.</b>	<b>પાણીના તમામ પ્રકારના બહાર કરવામાં આવતા ઉપયોગો પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ લાદવામાં આવેલ છે.</b>
<b>At this time don't:</b>	<b>આ સમયે આટલું કરશો નહીં:</b>
<ul style="list-style-type: none"> <li>Water lawns, gardens, flowers, trees and shrubs with City water</li> </ul>	<ul style="list-style-type: none"> <li>હરિયાળી પરિસર, બગીચા, ફૂલો, વૃક્ષો અને થડ વિનાના ઝાડવાંને શહેરના પાણીનો ઉપયોગ કરીને પાણી પિવડાવવું</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Fill outdoor pools or hot tubs</li> </ul>	<ul style="list-style-type: none"> <li>બહાર આવેલા પૂલ અથવા હોટ ટબને ભરવું</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Wash outdoor surfaces, including: <ul style="list-style-type: none"> <li>Windows</li> <li>Exterior building surfaces</li> <li>Sidewalks, driveways or walkways</li> </ul> </li> </ul>	<ul style="list-style-type: none"> <li>અહીં જે આપેલી છે તેના સહિતની બહારની સપાટીઓને ધોવી: <ul style="list-style-type: none"> <li>બારીઓ</li> <li>ઇમારતની બહારની સપાટીઓ</li> <li>ફૂટપાથ, વાહન ચલાવવાના માર્ગો અથવા પગદંડીઓ</li> </ul> </li> </ul>
<ul style="list-style-type: none"> <li>Fill fountains or decorative water features</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ફુવારા અથવા પાણી દ્વારા સુશોભિત કરતી સુવિધાઓને ભરવી</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Wash your car in the driveway or street</li> </ul>	<ul style="list-style-type: none"> <li>તમારી મોટરને વાહન ચલાવવાના માર્ગ પર અથવા શેરીમાં ધોવી</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Use water for construction purposes such as grading, compaction or dust control</li> </ul>	<ul style="list-style-type: none"> <li>શ્રેણીકરણ, સઘનતા અથવા ધૂળના નિયંત્રણ જેવા બાંધકામ સંબંધિત કાર્યો માટે પાણીનો ઉપયોગ</li> </ul>
Thank you for your patience and cooperation during this time.	આ સમયમાં શાંતિ જાળવવા માટે અને સહકાર આપવા બદલ તમારો આભાર!
<b>Want to do more?</b>	<b>શું વધુ કરવા ઇચ્છો છો?</b>
Reducing indoor water and non-essential use will help our water treatment plants, rivers and reservoirs catch up with demand.	ઘરની અંદર પાણીના ઉપયોગને અને બિન-આવશ્યક ઉપયોગને ઘટાડવાથી આપણા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નદીઓ અને જળાશયોને માંગ પૂરી કરવામાં સહાય મળી રહેશે.
<b>Do You can help reduce your indoor water use by:</b>	<b>તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:</b>

<ul style="list-style-type: none"> <li>Using the dishwasher and washing machine only when required and with full loads</li> </ul>	<ul style="list-style-type: none"> <li>જ્યારે જરૂર હોય ત્યારે જ અને સંપૂર્ણ લોડ સાથે જ ડીશવોશર અને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Turning off humidifiers, ice machines and automatic sprinkler systems</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ભેજપ્રેરક, બરફના ચંત્રો અને સ્વ-ચાલિત પાણીનો છંટકાવ કરતી સિસ્ટમને બંધ કરીને</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Scraping your plate clean rather than rinsing off food</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ખોરાકને ઘોઈ નાંખવાને બદલે તમારી પ્લેટને સાફ કરો</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Washing vegetables and fruit in a partially filled sink or pot and then rinse them quickly</li> </ul>	<ul style="list-style-type: none"> <li>શાકભાજી અને ફળોને એક આંશિક રીતે ભરેલી ગેંડી અથવા વાસણમાં રાખી લીધાં બાદ તેને ઝડપથી ધોવા</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Keeping a job of drinking water in your fridge. Don't run the tap to get ice-cold water</li> </ul>	<ul style="list-style-type: none"> <li>તમારા ફ્રિજમાં પીવાનું પાણી ભરીને રાખો. બરફથી ઠંડુ કરેલું પાણી પીવા માટે નળ ચાલુ કરશો નહીં</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Turning off the tap when brushing teeth or shaving</li> </ul>	<ul style="list-style-type: none"> <li>જ્યારે બ્રશથી દાંત સાફ કરતા હોવ અથવા દાઢી કરતા હોવ ત્યારે નળ બંધ કરવા</li> </ul>
<ul style="list-style-type: none"> <li>Limiting showers to three minutes or less and keeping baths shallow if you're able to do so (e.g., people with mobility challenges).</li> </ul>	<ul style="list-style-type: none"> <li>તમારા ફૂવારા નીચે સ્નાન કરવાને ત્રણ મિનિટ અથવા તેનાથી ઓછા સમય માટે મર્યાદિત કરો અને જો તમે કરી શકો તેમ હોવ તો ઓછા પાણીથી સ્નાન કરો (દા.ત. હલન-ચલન સંબંધિત પડકાર ધરાવનાર લોકો).</li> </ul>